

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રમ્પટન ઉજવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિન

બ્રમ્પટન, ઓન્ટારિયો (24 ફેબ્રુઆરી 2022) – સીટી ઓફ બ્રમ્પટન આંતરરાષ્ટ્રીય મહિલા દિન માર્ચ 8ના રોજ ઉજવશે જેમાં મહિલા બ્રમ્પટનવાસીઓનો પ્રભાવ અને સિદ્ધિઓ અંગે જાગૃતતા લાવવા માટે રૂબરૂ ઇવેન્ટ્સ હાથ ધરાશે જેમણે આજના બ્રમ્પટનને જીવવાલાયક, સહિષ્ણુ અને સમૃદ્ધ શહેર બનાવ્યું છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પેનલ ચર્ચાઓ અને મુખ્ય સંબોધન
8 માર્ચ, સાંજે 5 - 7 વાગ્યા સુધી

ઓન્ટારિયો ક્લબ ઓફ બ્રમ્પટન-કેલેડોનના સહયોગમાં સીટી ઓફ બ્રમ્પટન રજૂ કરે છે બે વ્યક્તિગત પેનલ ચર્ચાઓનો કાર્યક્રમ જેનું સંચાલન જામ ગેમ્બલ દ્વારા કરાશે અને સંકલન શેરમેન વિલિયમ્સ અને રોવેના સેન્ટોસ દ્વારા થશે.

- મહિલાઓ સામેની હિંસાને ના કહો: માનવ તસ્કરી
- સ્થાનિક મહિલાઓ અને કેવી રીતે તેણી બ્રમ્પટનના મહિલા સશક્તિકરણના દૃશ્યમાં યોગદાન આપે છે

આ સત્રોના સમાપન બાદ સમરા ઝફર દ્વારા મુખ્ય સંબોધન થશે જેઓ પુરસ્કાર વિજેતા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત વક્તા, બેસ્ટ સેલિંગ લેખિકા અને સમાનતા, માનસિક આરોગ્ય અને માનવ અધિકારોના અધ્યાપિકા છે.

આ સત્રોમાં આવા મહત્વપૂર્ણ વિષયોની છણાવટ કરવા માટે વિશેષજ્ઞો અને સમુદાયના ભાગીદારો ભેગા મળશે.

ઇવેન્ટના પ્રાયોજક કોકા-કોલા કેનેડા બોટલિંગ લિમિટેડનો સહય આભાર.

આંતરરાષ્ટ્રીય મહિલા દિનના ઇવેન્ટ વિશેની વધુ માહિતી માટે મુલકાત લો brampton.ca/IWD

એક્સપિરિયન્સ બોક્સ

આ મર્યાદિત સંસ્કરણવાળા ક્યુરેટ કરેલા ગિફ્ટ બોક્સમાં એવા ઉત્પાદો અને સેવાઓ હશે જે સ્થાનિક મહિલાઓની માલિકીના વ્યવસાયો પાસેથી આવ્યા હોય. તમામ બોક્સમાં હશે:

- Moodgxl ઉત્પાદિત હાયડ્રેટિંગ ફેસ માસ્ક
- સંકલ્પ પ્રોજેક્ટ દ્વારા અફરમેશન કાર્ડ
- Aroma Comforts 4 U ઉત્પાદિત બાથ બોમ્બ્સ
- Fruits and Roots Holistics ઉત્પાદિત હર્બલ બાથ સોલ્ટ્સ
- અને બીજું ઘણું!

[The Ellen House](#) ને ઓછામાં ઓછા \$20નું સખાવતી દાન કરનાર પ્રથમ 50 લોકોને આ બોક્સ પહોંચાડવામાં આવશે.

ઉદ્યોગસાહસિકોનું સશક્તિકરણ

બ્રમ્પટન આંત્રપ્રુન્યોર સેંટર આનંદ સાથે જણાવે છે કે આગામી ત્રણ ઈવેન્ટ્સમાં સહયોગ આપવામાં આવશે જેથી લિંગ સમાનતાને આગળ ધપાવવા માટેની ચર્ચાનો દોર શરૂ થઈ શકે, સફળતાને વરેલી મહિલા અગ્રણીઓ સાથે અર્થપૂર્ણ વાર્તાલાપો થઈ શકે અને આપણા સમુદાયમાં રહેલ વ્યવસાયિક મહિલાઓને વધાવી શકાય.

- માર્ચ 2: [InspiHer](#) બ્રમ્પટન બોર્ડ ઓફ ટ્રેડ દ્વારા આયોજીત
- માર્ચ 9: બ્રમ્પટન બોર્ડ ઓફ ટ્રેડ દ્વારા આયોજીત [#BreakTheBias](#) કેનેડાના કાર્યસ્થળોનો બદલાતો ચહેરો
- માર્ચ 10: સ્ટાર્ટઅપ પીલ દ્વારા આયોજીત [IWD2022 #BreakTheBias](#)

સુવાક્યો

"આજના બ્રમ્પટનના નિર્માણમાં જેમણે અગત્યની ભૂમિકા ભજવી છે એવી આપણા સમુદાયની સમર્પિત મહિલાઓની સિદ્ધિઓને વધાવીશું એવા આ આંતરરાષ્ટ્રીય મહિલા દિને અમારી સાથે જોડાઓ. હું બધાને ઓન્ટા ક્લબ બ્રમ્પટન-કેલેડન સાથે અર્થપૂર્ણ ચર્ચામાં ભાગ લેવા અને પુરસ્કાર વિજેતા વક્તા સમરા ઝફરનું સંબોધન સાંભળવા માટે 8 માર્ચની ઈવેન્ટમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરું છું."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"માર્ચ 3ના રોજ, આંતરરાષ્ટ્રીય મહિલા દિને આપણે મૂળભૂત પરિવર્તનો લાવવાની આપણી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવીશું જેથી સંપૂર્ણ લિંગ સમાનતા હાંસલ કરી શકાય જ્યારે આણે એવા લોકોનું સન્માન કરીશું જેમણે આ શહેર પર પોતાના કાર્યની છાપ છોડી છે. કટલીક મહત્વપૂર્ણ ચર્ચાઓમાં આપણને દોરવા માટે સમરા ઝફર, જેમ ગેમ્બલ અને ઝોન્ટા ક્લબ બ્રેમ્પટન-કેલેડન સાથે હોવાનું અમને ગૌરવ છે.

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5

"આ આંતરરાષ્ટ્રીય મહિલા દિને આપણે મહિલાઓની શક્તિ અને બળને વધાવીશું જેઓ આપણા સમુદાયની કરોડરજજૂ બનીને સહાય કરતી રહી છે. માનવ તરફની ગેરસમજ, લિંગ પૂર્વગ્રહ અને અન્ય બાબતો જેવા સમુદાય માટેના મહત્વપૂર્ણ વિષયો વિશે વાત કરવા માટે 8 માર્ચે હાથ ધરાશે તે વ્યક્તિગત પેનલ ચર્ચા અને મુખ્ય કાર્યક્રમમાં અમારી સાથે જોડાઓ. આ ઈવેન્ટને સફળ બનાવવા માટે આટલા બધા સમુદાય ભાગીદારો વચ્ચેનો સહયોગ જોવો તે આનંદની વાત છે."

- શેરમેન વિલિયમ્સ (Charmaine Williams) સીટી કાઉન્સિલર, વોર્ડ 7 અને 8

8મી માર્ચે તેમજ નિત્યક્રમે, એ મહત્વનું છે કે આપણે આપણા જીવનમાં ઘણી સ્ત્રીઓની મહત્વપૂર્ણ સિદ્ધિઓને વધાવી લઈએ અને તેની કદર કરીએ. સીટી ઓફ બ્રેમ્પટન ખાતેની ટીમમાં એવી જોરદાર મહિલાઓ સમાયેલ છે જેઓ આ સંગઠનમાં અને સમુદાયમાં એકતા વધારે છે, સફળ બનાવે છે અને તેનો વિકાસ કરે છે.

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca